



**Gujarat Narmada Valley  
Fertilizers & Chemicals Limited**  
CIN : L24110GJ1976PLC002903

An ISO 9001, ISO 14001, ISO 45001 & ISO 50001 Certified Company

P.O Narmadanagar - 392015, Dist. Bharuch, Gujarat, India  
Ph. (02642) 247001, 247002 Website: www.gnfc.in

NO.SEC/BD/SE/FR/2022-23  
November 11, 2022

FAX: 02642 – 247084  
E-Mail : [acshah@gnfc.in](mailto:acshah@gnfc.in)

Dy General Manager  
Corporate Relationship Dept  
BSE Ltd., 1st Floor, New Trading Ring,  
Rotunda Bldg, PJ Towers,  
Dalal Street, Fort  
Mumbai-400 001

The Manager  
Listing Department  
National Stock Exchange of India Ltd.  
Exchange Plaza, C-1, Block - "G",  
Bandra-Kurla Complex, Bandra (E)  
Mumbai – 400 051

**Company Code: "500670"**

**Company Code: "GNFC EQ"**

**Sub.:** Publication of Unaudited Standalone and Consolidated Financial Results for the Second Quarter and Half Year ended on 30<sup>th</sup> September, 2022 of FY 2022-23 in Newspapers - Compliance under Regulation 47 of the SEBI Listing Regulations, 2015.

Dear Sir,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed newspaper clippings of the advertisement regarding Unaudited Standalone and Consolidated Financial Results for the Second Quarter and Half Year ended on 30<sup>th</sup> September, 2022 of FY 2022-23 of the Company, approved by the Board in its Meeting held on 10<sup>th</sup> November, 2022 in the following newspapers:

1. Ahmedabad Edition of "Business Standard"
2. Vadodra Edition of "Sandesh" and;
3. Ahmedabad Edition of "The Indian Express".

The advertisement may also be accessed on the website of the Company [www.gnfc.in](http://www.gnfc.in).

We request you to kindly take note of the above.

Thanking you,

Yours faithfully,  
For GUJARAT NARMADA VALLEY FERTILIZERS & CHEMICALS LTD

ASHWINKUMAR  
CHIMANLAL SHAH

Digitally signed by  
ASHWINKUMAR CHIMANLAL  
SHAH  
Date: 2022.11.11 09:46:02  
+05'30'

CS A C SHAH  
COMPANY SECRETARY & GM (LEGAL)

ENCL:A:A:



**RFP for TOT**

Bid/Package no.: 170/CGM(T)/HGCL/TOT/2022-23 Dated : 09/11/2022  
**RFP FOR INTERNATIONAL COMPETITIVE BIDDING**

The Government of Telangana through HGCL seek the Tolling, Operation, Maintenance and Transfer (TOT) of the Nehru Outer Ring Road in Hyderabad. Brief particulars of the Project are as follows:

Project Name	Length (Kms)	Initial Estimated Concession Value of Authority (Rs. Crores)	Last Date for receiving Bids
Tolling, Operation, Maintenance & Transfer of Nehru Outer Ring Road (from Km 0+000 to Km 158+000) in Hyderabad, Telangana	158.000	To be disclosed after receipt of Technical Bids and after declaring the Selected Bidder	16.01.2023 up to 11:00 hrs IST

The complete Bid document can be viewed / downloaded from the official portal of HMDA [www.hmda.gov.in](http://www.hmda.gov.in) or e-procurement portal of Government of Telangana (<https://tender.telangana.gov.in>) from 10.11.2022 Bid must be submitted online only at <https://tender.telangana.gov.in>. Technical submission of the bids received online shall be opened on 16.01.2023 (at 14:00 hours IST).

Pre bid meeting will be held on 29.11.2022. Any amendments to the RFP and Bid process will be notified through e-tender portal only.

Sd/- Chairman, HGCL/ Metropolitan Commissioner, HMDA.  
**Hyderabad Growth Corridor Limited**  
 HGCL Building, Khajaguda Road, Nanakramguda, Hyderabad-500104  
 Email: [ogmhgcl@gmail.com](mailto:ogmhgcl@gmail.com), Ph No: +914029559433

Issued By: Commissioner, I & PR Department, Government of Telangana




## GENERATING ALPHA THROUGH ORDINARY MEANS

Highest Ever

H1 RFO ₹ 5,283 Crores	H1 PBT ₹ 1,077 Crores	Q2 RFO ₹ 2,587 Crores
-----------------------------	-----------------------------	-----------------------------



**EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON SEPTEMBER 30, 2022**

A) Standalone Financial Results				₹ Crores
Sr. No.	Particulars	Quarter Ended	Quarter Ended	Year to Date
		30/09/2022 (Unaudited)	30/09/2021 (Unaudited)	30/09/2022 (Unaudited)
1	Total income from operations	2,587	2,096	5,283
2	Net Profit for the period (before tax, Exceptional and/or Extraordinary items)	316	417	1,077
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	316	417	1,077
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	237	282	806
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	247	326	746
6	Equity Share Capital	155	155	155
7	Other equity (excluding Revaluation Reserve)			
8	Earnings Per Share (of ₹ 10/- each) (not annualised) (for continuing operations)			
	(a) Basic: (₹)	15.29	18.19	52.00
	(b) Diluted: (₹)	15.29	18.19	52.00

B) Consolidated Financial Results				₹ Crores
Sr. No.	Particulars	Quarter Ended	Quarter Ended	Year to Date
		30/09/2022 (Unaudited)	30/09/2021 (Unaudited)	30/09/2022 (Unaudited)
1	Total income from operations	2,587	2,096	5,283
2	Net Profit for the period (before tax, Exceptional and/or Extraordinary items)	316	417	1,077
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	316	417	1,077
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	238	284	810
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	248	328	750
6	Equity Share Capital	155	155	155
7	Other equity (excluding Revaluation Reserve)			
8	Earnings Per Share (of ₹ 10/- each) (not annualised) (for continuing operations)			
	(a) Basic: (₹)	15.35	18.32	52.26
	(b) Diluted: (₹)	15.35	18.32	52.26

- Notes:**
- The above is an extract of the detailed format of the Financial Results for the quarter and half year ended on September 30, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the quarter and half year ended on September 30, 2022 is available on the Stock Exchange websites (<http://www.nseindia.com> and <http://www.bseindia.com>) and on the Company's website (<http://www.gnfc.in>).
  - The above standalone and consolidated financial results have been reviewed by the Audit Committee at its meeting held on November 09, 2022 and approved by the Board of Directors at its meeting held on November 10, 2022. The statutory auditors of the Company have carried out a 'limited review' of these results.
  - Figures in the results are rounded off to the nearest ₹ Crore, except Earnings Per Share.
  - Previous period / year figures have been re-grouped / re-classified / re-casted wherever necessary to conform with current period presentation.

For and on behalf of the Board of Directors,  
 Pankaj Joshi, IAS  
 Managing Director

**Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited**  
 P.O. Narmadanagar - 392 015, Dist. Bharuch (Gujarat), India  
 An ISO 9001, ISO 14001, ISO 45001 & ISO 50001 Certified Company  
 CIN : L24110GJ1976PLC002903, Tele Fax No. : 02642-247084  
 Website: [www.gnfc.in](http://www.gnfc.in) | [www.gnfcneem.in](http://www.gnfcneem.in)



**PUBLIC NOTICE**

Notice is hereby given to public at large that Property being Sub Plot No.D/62 (As per Approved Plan Block No-G), Land area admeasuring 180.32 Sq.Mtrs With Construction area admeasuring 129.57 Sq.Mtrs, in the Scheme Known as "Vivekanand Industrial Estate" Rakhial, Ahmedabad constructed on non agriculture land bearing of Final Plot No-39 Palki Sub Plot No-4/2 of Town Planning Scheme No-11 in lie of Revenue Survey No-4,2,8,5/A, 5/B/1 & 7 of Mouje-Rakhial, Taluka-Maninagar. Registration district Ahmedabad and Sub district at Ahmedabad-07(Odhav) is presently owned and possessed by Snehil Prafulchandra Sakhidas & Ashit Prafulchandra Sakhidas. Further, Cash Credit / GECL loan was taken in the name of M/s F. SAKIDAS, a proprietorship firm, against the mortgage of said property from IDBI Bank Limited, C.G. Road Branch, Ahmedabad.

It is stated that following documents of above mentioned property i.e. 1). Original Reg. sale deed under serial No-3353, Dated-20-03-2008 along with its RR, 2). Original reg sale deed under Serial No-11790 dated-31-08-2010 along with its RR & 3). Share Certificate No-201 has been misplaced & not traceable at bank.

In case anybody has any prior charge, lien or an interest of any nature in respect of the said property should inform about such charge, lien, or interest with sufficient documentary evidence to the below mention address within 7 days from the date of this notice, failing to which it will be constructed that titles of the said property in favour of Present owner Alkaben Nareshkumar Doshi is absolute clear, marketable and no party has any lien charge, interest or any claim of whatsoever nature on the said Property other than IDBI Bank Limited, C.G. Road Branch, Ahmedabad.

**Jignesh B. Patel, Advocate • Devang H. Dave, Advocate**  
 Date: 11/11/2022 Office: 815, Eighth Floor, Ship Zaveri, Nr. Shyamal Cross Place: Ahmedabad Road, Satellite, Ahmedabad-380015. (M) 9375809431

**NESCO LIMITED**

**EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30 SEPTEMBER 2022**

Sr. No.	Particulars	₹ in Lakhs					
		Quarter Ended			Half Year Ended		Year Ended
		30.09.2022 (Unaudited)	30.06.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	31.03.2022 (Audited)
1	Total Income from Operations	15,850.32	11,084.60	9,056.72	26,934.92	17,635.79	38,241.21
2	Net Profit/(Loss) for the Period (Before Tax, Exceptional and/or Extraordinary Items)	10,442.00	6,337.86	5,064.97	16,779.86	10,112.83	22,646.00
3	Net Profit/(Loss) for the Period (Before Tax, After Exceptional and/or Extraordinary Items)	10,442.00	6,337.86	5,064.97	16,779.86	10,112.83	22,646.00
4	Net Profit/(Loss) for the Period (After Tax, After Exceptional and/or Extraordinary Items)	8,189.89	5,370.28	4,398.75	13,560.17	8,634.68	18,917.12
5	Total Comprehensive Income for the Period (Comprising of Profit for the Period [After Tax] and Other Comprehensive Income [After Tax])	8,192.15	5,367.30	4,399.92	13,559.45	8,637.10	18,964.91
6	Equity Share Capital (Face Value ₹ 2/- per share)	1,409.20	1,409.20	1,409.20	1,409.20	1,409.20	1,409.20
7	Reserves (excluding Revaluation Reserve)	-	-	-	-	-	1,68,364.82
8	Earning Per Share (EPS)						
	a) Earning Per Share Basic (in ₹) (*Not Annualised)	*11.62	*7.62	*6.24	*19.25	*12.25	26.85
	b) Earning Per Share Diluted (in ₹) (*Not Annualised)	*11.62	*7.62	*6.24	*19.25	*12.25	26.85

**Notes:**  
 1 Additional information on Unaudited Standalone Financial Results for the Quarter and Half year ended 30 September 2022.

Sr. No.	Particulars	₹ in Lakhs					
		30.09.2022 (Unaudited)	30.06.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	30.09.2022 (Unaudited)	30.09.2021 (Unaudited)	31.03.2022 (Audited)
a	Total Income from Operations	15,850.32	11,084.60	9,054.78	26,934.92	17,620.35	38,216.37
b	Profit Before Tax	10,443.97	6,340.38	5,066.83	16,784.35	10,108.50	22,651.18
c	Profit After Tax	8,191.86	5,372.80	4,400.55	13,564.66	8,630.29	18,922.24
d	Total Comprehensive Income for the Period	8,194.12	5,369.82	4,401.72	13,563.94	8,632.71	18,970.03

- These financial results have been reviewed and recommended by the Audit Committee approved by the Board of Directors in its meeting held on 10 November 2022.
- The above is an extract of the detailed format of Consolidated Unaudited Financial Results for the Quarter and Half year ended on 30 September 2022, filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of Standalone and Consolidated Financial Results are available on the website of the Stock Exchange ([www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com)) and on the Company's website ([www.nesco.in](http://www.nesco.in)).

For Nesco Limited  
 Sd/-  
 Krishna S. Patel  
 Chairman and Managing Director  
 DIN : 01519572

Mumbai, 10 November 2022  
 Registered Office : Nesco Center, Western Express Highway, Goregaon (East), Mumbai 400063  
 CIN: L17100MH1946PLC004886  
 website: [www.nesco.in](http://www.nesco.in)

#BSMorningShow







**What does the G20 presidency mean for India?**



**How indigenous is India's 5G technology?**



**Should you bet on new-age tech stocks after a mixed Q2?**



presents

**Business Standard MORNING SHOW**

Mon - Fri | 8am

Get the answers in today's episode



Visit [mybs.in/MorningShow](http://mybs.in/MorningShow) or scan this code to watch.

bsindia

business-standard.com







# 5 GUJARAT

## BRITISH ARCHITECTURAL HISTORIAN IN LETTER Board lacks transparency, rebrand IIMA, says Curtis

EXPRESS NEWS SERVICE  
AHMEDABAD, NOVEMBER 10

RENOWNED BRITISH architectural historian William JR Curtis has accused the Indian Institute of Management Ahmedabad (IIMA) Board of lack of transparency in decisions and urged it to think outside the box and "rebrand their place... rather than skin-deep Americanisation".

In a letter to IIMA director, its Board of Governors and alumni on Thursday, Curtis said, "Mercantile concerns are allowed to triumph over human and cultural concerns: this is 'business today' in the era of 'disaster capitalism'." The letter came after the Board announced on November 3 its decision to stop restoration work of buildings on the old campus and go-ahead with reconstruction.

The letter was also marked to International Committee for Documentation and Conservation of Buildings, Sites and Neighbourhoods of the Modern Movement (DOCOMOMO), International Council on Monuments and Sites (ICOMOS), International Committee of Architectural Critics (ICAC), International Conference on Architectural Quality (ICAQ) and World Monuments Fund.

"IIMA need to think outside the box and realise that they have a chance to 'rebrand' their place in relation to a great local history and tradition, rather than a skin-deep Americanisation," it said.

Referring to the latest structural report by the Indian Institute of Technology (IIT) Roorkee that was cited by IIMA director Prof Enrol D'Souza as the "major deciding factor" behind the decision, Curtis said, "There is a lack of transparency in these decisions. Apparently a team of engineers from IIT Roorkee prepared a report, but the IIMA administration is refusing to make this public. As

for the architectural assessment, this has been made by American architects, but there too there is a refusal to reveal their judgements, their criteria and even their identity. Why all this secrecy? Naturally there is suspicion of a 'white wash'."

On November 3, nearly two years after IIMA witnessed strong resentment from different communities, including children of famous American architect Louis Kahn, for their decision to pull down dormitories on its old campus, D'Souza announced that the institute will discontinue restoration and take up reconstruction work, keeping Kahn's legacy.

"So here we are again two years down the line defending Kahn's magisterial city of learning at IIMA against the short-term interests of the institution housed there. In fact as temporary residents of a universal masterpiece, the administrators have long term responsibilities as custodians of a heritage that should be handed on with pride to future generations," the letter added.

The recent IIMA announcement "makes for curious reading" and that the "visionary Vikram Sarabhai who was the main force behind the foundation, must be turning in his grave" Curtis suggested, "One does not want to fossilise Kahn's scheme but one does need to respect its essential qualities, attributes and guiding principles. The challenge here is creative reuse, but in a manner that respects the integrity of the original; not the absolutely wasteful destruction of a masterpiece replaced by a third rate pastiche..."

Accusing the BJP government for attacking secular values and Nehruvian social projects, Curtis stated, "Under the Modi regime smash and grab capitalism has flourished combined with an anti-secular, anti-democratic

Hindu nationalism. Modern architecture associated with the Nehru period and with secular values and Nehruvian social projects has come under attack..."

Adding that this is a deliberate destruction of cultural and national memory to suit a particular political agenda and to bend to commercial greed, he said, "Some years back moves were made to demolish Le Corbusier's Millowner's Association Building in Ahmedabad and to 'develop' the plot of land for profit. The price of everything and the value of nothing; that is the new India under a plutocracy and global capitalism."

"Why be restricted to the modern era? Why not shift the axes at Fatehpur Sikri to suit some contemporary whim... Why not move the ceremonial lingam in the sublime Elephanta Cave so that it is easier for tourists to see it on arrival? Why not mess around a bit with the Taj Mahal..." Curtis said, adding that IIMA is a Fatehpur Sikri of the future and it should be preserved in its entirety as part of Indian and universal patrimony. Pointing out that "the next site in line for the critical project" is the campus of CEPT itself, he stated, "As it happens there is also an architectural project to redo parts of the CEPT campus. The architect? ...Join up the dotted lines."

Suggesting to continue to restore the buildings while adapting them intelligently and sensitively to present and future needs, he stated that an IIMA thus restored should acquire the status of Universal Patrimony of Humanity, UNESCO Protection.

"It would be tragic if Kahn's great work were to be demolished when it can certainly be restored and refurbished. It is so rare to find architecture of this level in any period or place in the history of architecture. Kahn's IIM is timeless but of its time," he states.

## MORBI TRAGEDY Rs 5-crore endowment for 20 children who lost one or both parents

EXPRESS NEWS SERVICE  
AHMEDABAD, NOVEMBER 10

ADANI FOUNDATION, the corporate social responsibility arm of the Adani Group, on Thursday announced an endowment of Rs 5 crore to 20 children who have lost either one or both parents in the Morbi bridge collapse. The bridge collapse killed 135 persons, including 55 children.

In a press release, the Adani Foundation stated that it is "working with the Morbi district administration to set up endowments of Rs 25 lakh each" for seven children who have been orphaned and 12 other children who lost one of their parents. Among the beneficiaries of the Rs 5 crore endowment corpus will also be an unborn child of a pregnant woman who lost her husband in the bridge collapse.

According to the press release, the foundation will place the funds in secured fixed deposits for the 20 children, keeping the principal amount intact while the interest goes towards supporting their needs. A commitment letter to this effect for the principal amount has been handed over to the Morbi District Collector, according to the foundation.

The press release quoted Priti Adani, chairperson of the foundation, as stating, "Among the most severely affected are the little ones, many of whom are yet to be told that their mother or father or both parents will never return home. The very least we can do in this time of great distress is to make sure that these children have the means to grow, get a proper education and lead fulfilling lives. This is why we decided to set up a fund to provide the financial support they need over their growing-up years."

## Changing candidates won't heal wounds of Morbi tragedy: Congress on BJP list

EXPRESS NEWS SERVICE  
AHMEDABAD, NOVEMBER 10

THE CONGRESS party on Thursday criticised the BJP for dropping senior leaders in Gujarat and said changing candidates will not heal the wounds of Morbi or help hide corruption and inaction during the Covid-19 pandemic.

Pointing out that 38 sitting MLAs and sitting ministers were dropped in BJP's first list of candidates announced for the upcoming Gujarat elections, Alok Sharma, national spokesperson of the party, said, "You already know that the entire council of ministers

of the Rupani government was changed. Today all the ministers of that government — Vijay Rupani, Nitin Patel, RC Faldu, Bhupendra Chudasama, Kaushik Patel, Saurabh Patel, Ganpat Vasava, Anil Parmar, Pradeepsinh Jadeja, Vibhavi Dave, Yogesh Patel — do not figure in this list."

Sharma added, "First your government failed during the Covid pandemic and your cabinet kept people in the dark and could not provide even the basic facilities. Then you changed the entire council of ministers and today some of the new council of

ministers have been dropped. It only means that the government has not done any work."

Adding that by changing the candidate for Morbi, the wounds caused by the bridge collapse cannot be healed, Sharma said that the BJP has nominated a candidate who was recently released from jail. "By changing the ministers, you cannot hide corruption. By changing the MLAs, you can't hide the fact that you failed to provide even oxygen during the pandemic," he said. The Congress spokesperson

pointed out that BJP MLAs who won with large margins in 2017 have been dropped for the 2022 polls. "Pradip Parmar who won with more than 50,000 votes, Pradeepsinh Jadeja who won with one lakh votes, Rajendra Trivedi with victory margin of 40,000 votes have been dropped. "You (BJP) had a report that said all of them were losing," he claimed.

Questioning the stability of the BJP government, he asked, "In six years, you had three chief ministers, two council of ministers... about 20 people on this list are those who have quit the Congress and joined the BJP... How is this a stable government?"



DECISION  
2022  
GUJARAT



75  
Azadi Ka  
Amrit Mahotsav

## GENERATING ALPHA THROUGH ORDINARY MEANS

Highest Ever

H1 RFO ₹ 5,283 Crores	H1 PBT ₹ 1,077 Crores	Q2 RFO ₹ 2,587 Crores
-----------------------------	-----------------------------	-----------------------------



**ISER**  
INDIAN INSTITUTE OF SCIENCE EDUCATION AND RESEARCH, TIRUPATI  
(An Autonomous Institute under Ministry of Education, Govt. of India)

**RECRUITMENT FOR THE POSTS OF "SECURITY OFFICER & SECURITY SUPERVISOR" PURELY ON CONTRACT BASIS**

ISER Tirupati invites online applications from Indian nationals having excellent academic record and relevant work experience for the posts of Security Officer & Security Supervisor purely on contract basis.

For detailed advertisement, please visit [www.isertirupati.ac.in](http://www.isertirupati.ac.in) and click on the link "Job Opportunities-Technical/Administration".

The last date for submission of online applications is **December 05, 2022**.

Advt.No.41/2022/ISER-T/Recd./11.11.2022

Sd/-  
Registrar

**SUNDARAM HOME**  
SUNDARAM HOME FINANCE LIMITED  
Regd. Office: No. 21, Patulos Road, Chennai-600002. Tel: 044-2852 1181  
Corporate Office: "Sundaram Towers" 46, Whites Road, Chennai - 600014.  
Tel: 044-2851 5267, Fax: 044-2858 2235, Email: [corporateaffairs@sundaramhome.in](mailto:corporateaffairs@sundaramhome.in)  
Website: [www.sundaramhome.in](http://www.sundaramhome.in) CIN: U65922TN1999PLC042759

Sundaram Home Finance Limited has decided to close its operations at its existing Vadodara branch located at, C/o Sundaram Finance Limited, Office No. 518 & 519, 5th Floor Centre Point, Alkapuri, Vadodara - 390005, on 13th February 2023. Customers / Depositors of this branch will be served by our new office at 2nd Floor, Alpha Building 16-A, Sudhanagar Society, Near Vijay Sales, Chakli Circle to Jetalpur road, Vadodara - 390007, with effect from 14th February 2023.

Place: Chennai for SUNDARAM HOME FINANCE LIMITED  
Date: 11/11/2022 S. Sridhar Chief Financial Officer

**HDFC BANK** HDFC Bank Ltd., 3rd Floor, Shivaitik - III, Above Axis Bank, Near Drive In Cinema, Ahmedabad-380054. Ph: 079-61738096

**POSSESSION NOTICE**

Whereas,

The undersigned being the Authorized Officer of the HDFC Bank Limited under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13 read with the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 10.11.2021 calling upon the Borrowers (1) Madhu Pradeep Jain (2) Harsh Pradeepkumar Jain, to repay the amount mentioned in the notice being Rs.64,53,191.57 (For our Overdraft facility Account No. 50200007254702 Rs.17,98,278.57 & For Loan Against Property Account No. 81125540 Rs.46,54,913.930) Rupees Sixty Four lakh Fifty Three Thousand One Hundred Ninety One and Fifty Seven Paise Only) as on 27.10.2021 with further interest and expenses within 60 days from the date of notice of the said notice in their Overdraft facility Account No. 50200007254702 and Loan Against Property Account. 81125540.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken Physical possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 06th Day of November of the year 2022.

The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the HDFC Bank Limited for an amount of Rs.64,32,406.17 as on 05.11.2022 and interest & expenses thereon till the full payment. The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**DESCRIPTION OF PROPERTY**

All The Piece And Parcel of Immovable Residential Tenement No.25, Niharika Bunglows, Near Himmatlal Park, Near Shahjahan College Circle, Amabawadi-380006 and having area Admeasuring 100.32 Square Meter and super structure there on. Further situated at District Ahmedabad, Sub District Ahmedabad 3, (Memnagar), City Taluka : Ahmedabad, Mouje Village : Vastrapur, Revenue Survey No. 46, Town Planning Scheme No. 31, Final plot No.44,45 and 46, The constructed Tenement by Gujarat Housing Board identified as Paikae of Block No. H-13 wherein aforesaid Tenement No. 25 is situated at Ahmedabad and bounded as under. Boundary: East : Tenement No. 24 after margin space, West : Tenement No.26, North : Tenement No. A-14 after margin space, South: Road

Date : 06.11.2022 Place: Ahmedabad Authorised Officer, HDFC Bank Ltd.

**FAZE THREE Autofab Limited**  
CIN: L17120DN1997PLC000196  
Website: [www.fazethreeautofab.com](http://www.fazethreeautofab.com) | E-mail : [cs@fazethreeautofab.com](mailto:cs@fazethreeautofab.com) | Tel.: 022-43514444/400  
Regd.Off. : Plot No. 445, Waghdhara Village Road, Dadra, UT of Dadra & Nagar Haveli and Daman & Diu - 396193  
EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2022  
(Rs. In Crores except EPS data)

Particulars	QUARTER ENDED		HALF YEAR ENDED		Year Ended
	Sept 30, 2022	Sept 30, 2021	Sept 30, 2022	Sept 30, 2021	March 31, 2022
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
Total Income from Operations	39.34	38.58	89.43	71.01	196.03
Net profit/ (loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary item)	2.26	4.24	5.40	7.79	15.09
Net profit/ (loss) for the period before Tax (After Exceptional and/or Extraordinary item)	2.26	4.24	5.40	7.79	15.09
Net profit/ (loss) for the period after Tax (After Exceptional and/or Extraordinary item)	1.04	3.63	3.31	6.74	12.95
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1.04	3.63	3.31	6.74	12.96
Paid-up Equity Share Capital (Face value ₹10/- per share)	10.72	10.72	10.72	10.72	10.72
Reserves excluding Revaluation Reserve (Other Equity)	0.00	0.00	0.00	0.00	38.89
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -					
Basic:	0.97	3.39	3.09	6.29	12.08
Diluted:	0.97	3.39	3.09	6.29	12.08

Notes:

- The above is an extract of the detailed format of statement of Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The detailed financial results and this extract were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on November 10, 2022. The full format of the Statement of Financial Results are available on the Company's website ([www.fazethreeautofab.com](http://www.fazethreeautofab.com)) and on the website of BSE Limited ([www.bseindia.com](http://www.bseindia.com)).
- The Financial Results, for the quarter and half year ended September 30, 2022 have been subjected to limited review by the statutory auditors. The financial results, for the year ended March 31, 2022 have been audited by the auditors. The figures for the previous quarter/year have been re-grouped/ re-classified wherever necessary, to make them comparable.

By Order of the Board  
For FAZE THREE Autofab Limited

Sd /-  
V. Sivakumar  
Whole-time Director & CFO  
DIN:09211111

Place: Mumbai  
Date: November 10, 2022

### EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON SEPTEMBER 30, 2022

A) Standalone Financial Results					₹ Crores
Sr. No.	Particulars	Quarter Ended	Quarter Ended	Year to Date	
		30/09/2022 (Unaudited)	30/09/2021 (Unaudited)	30/09/2022 (Unaudited)	
1	Total income from operations	2,587	2,096	5,283	
2	Net Profit for the period (before tax, Exceptional and/or Extraordinary items)	316	417	1,077	
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	316	417	1,077	
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	237	282	806	
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	247	326	746	
6	Equity Share Capital	155	155	155	
7	Other equity (excluding Revaluation Reserve)				
8	Earnings Per Share (of ₹ 10/- each) (not annualised) (for continuing operations)				
	(a) Basic: (₹)	15.29	18.19	52.00	
	(b) Diluted: (₹)	15.29	18.19	52.00	

  

B) Consolidated Financial Results					₹ Crores
Sr. No.	Particulars	Quarter Ended	Quarter Ended	Year to Date	
		30/09/2022 (Unaudited)	30/09/2021 (Unaudited)	30/09/2022 (Unaudited)	
1	Total income from operations	2,587	2,096	5,283	
2	Net Profit for the period (before tax, Exceptional and/or Extraordinary items)	316	417	1,077	
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	316	417	1,077	
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	238	284	810	
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	248	328	750	
6	Equity Share Capital	155	155	155	
7	Other equity (excluding Revaluation Reserve)				
8	Earnings Per Share (of ₹ 10/- each) (not annualised) (for continuing operations)				
	(a) Basic: (₹)	15.35	18.32	52.26	
	(b) Diluted: (₹)	15.35	18.32	52.26	

- Notes:
- The above is an extract of the detailed format of the Financial Results for the quarter and half year ended on September 30, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the quarter and half year ended on September 30, 2022 is available on the Stock Exchange websites (<http://www.nseindia.com> and <http://www.bseindia.com>) and on the Company's website (<http://www.gnfc.in>).
  - The above standalone and consolidated financial results have been reviewed by the Audit Committee at its meeting held on November 09, 2022 and approved by the Board of Directors at its meeting held on November 10, 2022. The statutory auditors of the Company have carried out a 'limited review' of these results.
  - Figures in the results are rounded off to the nearest ₹ Crore, except Earnings Per Share.
  - Previous period / year figures have been re-grouped / re-classified / re-casted wherever necessary to conform with current period presentation.

For and on behalf of the Board of Directors,  
Pankaj Joshi, IAS  
Managing Director

### Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited

P.O. Narmadanagar - 392 015, Dist. Bharuch (Gujarat), India  
An ISO 9001, ISO 14001, ISO 45001 & ISO 50001 Certified Company  
CIN : L24110GJ1976PLC002903, Tele Fax No. : 02642-247084  
Website: [www.gnfc.in](http://www.gnfc.in) | [www.gnfcneem.in](http://www.gnfcneem.in)

